

ત્વરિત જાહેરાત માટે

## બ્રેમ્પટન સીટી કાઉન્સિલે મેન્ડેટરી ફેસ ક્વરિંગ્સ બાય-લૉ (પેટા-કાનૂન) મંજૂર કર્યો

*એક મિલિયન નોન-મેડિકલ મારક્સ બ્રેમ્પટનવાસીઓને વહેંચવામાં આવશે*

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જુલાઈ 9, 2020) – શુક્રવાર, જુલાઈ 10 થી, બ્રેમ્પટનમાં બંધી ઈનડોર જાહેર જગ્યાઓમાં નોન-મેડિકલ મારક્સ કે ફેસ ક્વરિંગ્સ પહેરવા અનિવાર્ય બનશે જેથી COVID-19 નો ફેલાવો રોકવામાં મદદ મળે.

પીલ પબ્લિક હેલ્થની સલાહને અનુસરીને, બ્રેમ્પટન સીટી કાઉન્સિલે ગઈકાલે બ્રેમ્પટન COVID-19 મેન્ડેટરી ફેસ ક્વરિંગ્સ બાય-લૉ પસાર કર્યો, જે ઓક્ટોબર 1, 2020 સુધી અમલમાં રહેશે. આ પગલામાં સમુદાયને સહાયરૂપ થવા, સીટી શરૂઆતમાં બ્રેમ્પટનમાં દરેક ઘરને ત્રણ મારક્સ મેઈલમાં મોકલીને, રહેવાસીઓને એક મિલિયન નોન-મેડિકલ મારક્સ વહેંચવાનું છે.

આ હંગામી બાય-લૉ (પેટા-કાનૂન)માં જાહેર સંસ્થાઓ અને ધંધાઓએ પોતાના નિયંત્રણ હેઠળની ઈનડોર જાહેર જગ્યાઓમાં મારક્સ કે ફેસ ક્વરિંગ્સ પહેરાતા હોવાની ખાતરી કરવી અનિવાર્ય બનશે.

નોન-મેડિકલ મારક્સ કે ફેસ ક્વરિંગ્સ અનિવાર્ય બનનારી જગ્યાઓમાં સામેલ છે:

- રિટેઈલ સ્ટોર્સ જ્યાં ગ્રાહકોને માલસામાન અને સેવાઓનું વેચાણ થતું હોય
- એ ધંધાઓ જે મુખ્યત્વે ખાદ્યપદાર્થો વેચતા હોય, જેમાં રેસ્ટોરન્ટ્સ, સુપરમાર્કેટ્સ, કરિયાણાની દુકાનો, બેકરી અને કન્વેનિયન્સ સ્ટોર્સ સામેલ છે
- ટેવળો, મસ્જીદો અને અન્ય પૂજના સ્થળો, ચહેરો ઢાંકવા સાથે અસંગત હોય તેવી ધાર્મિક વિધિ કે સમારોહ યોજવામાં આવે તે સિવાય
- ઈનડોર સામુદાયિક અને મનોરંજન સગવડો
- શોપિંગ મોલ્સ કે સરખી માળખાગત સગવડો જેમાં બહુવિધ ધંધાકીય સ્થળો સામેલ હોય
- અંગત સંભાળ સેવાઓ પૂરી પાડતા ધંધાઓ
- હોટેલ અને મોટેલના સામાન્ય વિસ્તારો અને અન્ય ટૂંક સમય માટે ચાલતી સવલતો
- પુસ્તકાલયો, સંગ્રહાલયો, ગેલેરી અને અન્ય સરખી સગવડો
- બેન્કવેટ હોલ્સ, સંમેલન કેન્દ્રો, અરેના (અખાડાઓ), સ્ટેડિયમો અને અન્ય આયોજન સ્થળો
- કન્સર્ટ સ્થળો, થિયેટરો, સિનેમા હોલ્સ, કેસિનો અને અન્ય મનોરંજન સ્થળો
- ઓપન હાઉસ, પ્રેઝન્ટેશન સેન્ટર તરીકે વપરાતી ઈમારતો, કે સ્થાવર મિલકત હેતુસરની અન્ય સગવડો
- સીટી ઓફ બ્રેમ્પટનમાં સંચાલિત અંગત પરિવહન કંપનીના વાહનો
- નગરપાલિકા દ્વારા સંચાલિત ઈમારતો
- અન્ય ધંધાઓ, સંસ્થાઓ અને સ્થળો જે કટોકટી હુકમો અનુસાર સંચાલન કરવાની પરવાનગી ધરાવતા હોય કે ધરાવતા હોઈ શકે.

આ બાય-લૉનું પાલન ન કરનારી વ્યક્તિઓ અને ધંધાઓને દરેક ગુના માટે લઘુત્તમ \$500 અને મહત્તમ \$100,000 સુધીનો દંડ થઈ શકે.

આ બાય-લૉ (પેટા-કાનૂન) આમને મુક્તિ આપે છે, તબીબી કારણોસર માર્ક કે ફેસ ક્વરિંગ ના પહેરી શકે તેવી વ્યક્તિઓ સહિતની ચોક્કસ વ્યક્તિઓને; બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને; કટોકટી હુકમો અનુસાર અથલેટિક (કસરતી) પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તમય લોકોને અને ઈનડોર સ્થળે

ખોરાક કે પીણું લેતા લોકોને (પ્રોવિન્સ ઈનડોર ડાઈનિંગ ફરીથી ખોલવાની છૂટ આપે ત્યારથી). સંપૂર્ણ યાદી માટે વેબસાઈટ જુઓ, [brampton.ca/masks](http://brampton.ca/masks).

જુલાઈ 2 સુધીમાં, બધી બ્રેમ્પટન ટ્રાન્ઝિટ બસોમાં અને ટર્મિનલ્સ પર નોન-મેડિકલ માર્ક્સ પહેરવા ફરજિયાત બન્યા છે.

પીલ પબ્લિક હેલ્થ દ્વારા દર્શાવવામાં આવેલી ચાર મુખ્ય રોકથામ કાર્યવાહીઓમાંની એક નોન-મેડિકલ માર્ક્સ કે ફેસ કવરિંગ્સ પહેરવા વિશે છે. ત્રણ અન્ય કાર્યવાહીઓમાં દૂર રહેવું, હાથ ધોવા કે હેન્ડ સેનિટાઈઝર વાપરવું, અને પરીક્ષણ કરાવવું જો તમે COVID-19 થયો હોવાનું અથવા તે થયેલ કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાનું વિચારો. વેબસાઈટ [peelregion.ca/coronavirus/core-four/](http://peelregion.ca/coronavirus/core-four/) જુઓ. નોન-મેડિકલ માર્ક્સ, ફેસ કવરિંગ્સ અને અન્ય અંગત સંરક્ષણાત્મક સાધન (પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ - PPE) નાં યોગ્ય ઉપયોગ વિશે વધુ જાણવા વેબસાઈટ [peelregion.ca/coronavirus/prevention/](http://peelregion.ca/coronavirus/prevention/) જુઓ.

ધંધાઓ અને સગવડ સંચાલકો માટે વધારાની માહિતી અને સંસાધનો વેબસાઈટ પર ઉપલબ્ધ છે, [brampton.ca/masks](http://brampton.ca/masks).

COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં સીટી ઓફ બ્રેમ્પટનની અદ્યતન માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, [brampton.ca/COVID19](http://brampton.ca/COVID19).

### અવતરણો (ક્વોટ્સ):

“અમે અમારા જાહેર આરોગ્ય અધિકારીઓ પાસેથી સાંભળ્યું છે તેમ, ફરજિયાત માર્ક્સ પહેરવા એ COVID-19 નો ફેલાવો રોકવાનો અભિન્ન ભાગ છે. આ વાઈરસથી દૂર રહીને આગળ વધવાનું ચાલુ રાખવા, અમે જરૂરી બધી સાવચેતીઓ રાખવા તૈયાર છીએ અને એટલે જ સીટી બ્રેમ્પટનવાસીઓને એક મિલિયન નોન-મેડિકલ માર્ક્સ વહેંચશે. હું સમગ્ર GTA માં માર્ક પહેરવાના સામૂહિક અભિગમથી પ્રોત્સાહિત થયો છું, અને જાણું છું કે બ્રેમ્પટનમાં આપણાં રહેવાસીઓ સમુદાયનું આરોગ્ય અને સુરક્ષાને અગ્રતા આપવામાં અને સંરક્ષણ પૂરું પાડવામાં પોતાનો ભાગ ભજવવાનું ચાલુ રાખશે.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“આપણું શહેર પ્રોવિન્સનો રિઓપનીંગ તબક્કો 2 માં પહોંચ્યું છે ત્યારે આપણે આપણાં સમુદાયના પ્રયત્નોના પરિણામો જોયા છે. આ મહેનતું કામગીરી અચૂક ચાલુ રહેવી જોઈએ. ઈનડોર જગ્યાઓમાં નોન-મેડિકલ માર્ક્સના ફરજિયાત ઉપયોગ જેવી કાર્યવાહીઓ પર આપણાં સ્થાનિક આરોગ્ય નિષ્ણાતોની સલાહ અનુસરીને રિકવરી તરફના આપણાં માર્ગ પર આપણે આગળ વધી શકીએ છીએ.”

- માર્ટિન મેડેરોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; લીડ (આગેવાન), મેયરનું રિઓપનીંગ એન્ડ રિકવરી વર્કિંગ ગ્રૂપ, સીટી ઓફ બ્રેમ્પટન

“આ શહેરનું ધીરે ધીરે અને સુરક્ષિત રીતે સેવાઓ ફરી ખોલવાનું ચાલુ છે ત્યારે, અમે COVID-19 નો ફેલાવો ટાળવામાં મદદ મળે તેવી દરેક તક પર કાર્યવાહી કરી રહ્યાં છીએ. નોન-મેડિકલ માર્ક્સ ફરજિયાત બનાવવા એ આપણાં સમુદાય અને અર્થતંત્રના શ્રેષ્ઠ હિતમાં છે, અને અમે અમારા કર્મચારીઓ, રહેવાસીઓને સહાયરૂપ થવા બંધુ કરીશું કારણ કે આ મહામારી સમગ્ર શહેરમાં ફેલાઈ છે.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

### મિડિયા સંપર્ક :

મોનિકા દુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)